

Arunis Abode Limited

CIN : L70100GJ1994PLC021759



Regd. Office : Desai House, S.No. 2523, Coastal highway, Umersadi, Killa Pardi, Dist. Valsad - 396125, Gujarat. Mob.: +91 70456 77788 Website: www.arunis.co

Corp. Office : 501, Flyedge - FP No 765, TPS 111, JN Off SV Road and Kora Kendra Road, Borivali (W) Mumbai- 400092. Mob.: +91 9167869000 Email : corporate@arunis.co

Date: 21-08-2024

To,

The Manager – Corporate Service Department
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai – 400001.

Scrip Code: 526935

Sub: Regulation 30 SEBI (LODR) Regulations, 2015 - Intimation of Newspaper Publication - Information regarding 30th Annual General Meeting of the Company

Dear Sir/ Madam,

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copies of the pre-dispatch information regarding the 30th Annual General Meeting, as published today on August 21st, 2024, in Financial Express (English Edition) and Ahmedabad Express (Gujarati Edition).

You are requested to kindly take the same on your record.

Thanking you,

Yours sincerely,

FOR ARUNIS ABODE LIMITED

Garima Mandhania

Company Secretary & Compliance Officer

M. No.- A62347

EURO CERAMICS LIMITED (In Liquidation)
Liquidator Office- 304, Abhijit-3, Netaji Road, Mithakhali Circle, Ahmedabad-06

E-AUCTION SALE NOTICE UNDER IBC 2016

Notice is hereby given to public in general by liquidator appointed by the Hon'ble NCLT Bench Mumbai vide order dated 06.09.2023 for sale of assets of Euro Ceramics Limited - In Liquidation (Corporate Debtor) forming part of Liquidation Estate under the provision of the Insolvency and Bankruptcy Code, 2016 and Regulations made thereunder.

Last date for submission of eligibility documents	07.09.2024
Last date of submission of bid and EMD	14.09.2024
Date of e-auction Sale	17.09.2024

Item No.	Assets Description of the Corporate debtor	Reserve Price-Rs.	Earnest Money Deposit - Rs.	Bid Increment Value-Rs.
1	Stock and Store Material at Bhachau Dist- Kutchh (Gujarat)	2,69,73,000	26,97,300	1,00,000
2	Sale of immovable property of land admeasuring approx. 5.82.749 Sq. mtr situated at Bhachau Dist - Kutchh (Gujarat)	44,00,00,000	4,40,00,000	5,00,000

Terms and Condition of the E-Auction are as under:

- E-Auction sale will be conducted on "AS IS WHERE IS", "AS IS WHAT IS", "WHATEVER THERE IS" and "NO RECOURSE BASIS" through approved service providers E-Procurement Technologies Ltd, through its website <https://ncltauction.auctiontger.net> and as such, the sale shall be without any kind of warranties and indemnities.
- The Complete E-Auction process document containing details of the assets, online e-auction bid form, Declaration and Undertaking Form, terms and Conditions of online auction sale are available on the website <https://ncltauction.auctiontger.net>. Contact : 079-68136880 / 881 / 837 / 842 Email - support@auctiontger.net or can be obtained through an email at : ecliquidation@gmail.com.

Sd/-
CA Premraj Ramratan Laddha
Liquidator, Euro Ceramics Limited in liquidation
IBBI Regn No.: IBBI/HPA-001/PP-P00060/2017-2018/10138
Place : Ahmedabad
Date : 17.08.2024

ARUNISABODE LIMITED
CIN: L70100GJ1994PLC021759

Regd. Office: Desai House, Survey No.2523, Coastal Highway, Umersadi, Killa Pardi, Noida-396126, Gujarat, India. Mobile No.: +91-7045677788; +91-916178 69000; Email: corporate@arunis.co; Website: www.arunis.co

NOTICE OF 30TH ANNUAL GENERAL MEETING OF ARUNIS ABODE LIMITED

NOTICE is hereby given that the 30th Annual General Meeting ("AGM") of the members of Arunis Abode Limited ("Company") will be held on Wednesday, 18th September 2024 at 04:30 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") in compliance with the provisions of the Companies Act, 2013 ("Act") and Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 read with all applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities and Exchange Board of India ("SEBI") without the physical presence of the members at a common venue, to transact the business as set out in the Notice of the 30th AGM dated 09th August 2024.

In accordance with the applicable MCA and SEBI circulars, the Notice of the AGM along with the Annual Report for the financial year ended 31st March 2024 will be sent through electronic mode only to those members, whose e-mail addresses are registered with the Company / Registrar and Share Transfer Agent ("RTA") / Depository Participants. The requirement of sending a hard copy of the Annual Report has been dispensed with vide said MCA and SEBI circulars. The Notice of the AGM and the Annual Report will also be available on the Company's website, www.arunis.co, the website of BSE Ltd. viz. www.bseindia.com, and the website of CDSL (agency for providing the remote e-voting facility and e-voting system during the AGM) i.e. www.evotingindia.com. The members can join and participate in the AGM through the VC/OAVM facility only. The Notice of the AGM provides detailed instructions for joining the AGM and the manner of participation in the remote e-voting or casting votes through the e-voting system during the AGM. The members attending the meeting through VC/OAVM will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

The cut-off date for the purpose of determining the eligibility of members for e-voting and attending the AGM has been fixed as Tuesday, 10th September 2024.

In order to register/update their email address, the members holding shares in demat form are requested to register the same with their respective Depository Participant(s), and members holding shares in physical form are requested to furnish the same to the Company RTA i.e. Link Intime India Private Limited in the prescribed form. The detailed procedure for registration/update of email addresses is provided in the Notice of the AGM. The members will have an opportunity to cast their vote remotely or during the AGM on the business as set forth in the Notice of the AGM through the electronic voting system. The manner of remote e-voting and e-voting during the AGM is provided in the Notice of the AGM. Any queries/grievances pertaining to the e-voting process can be addressed to the Company Secretary and Compliance Officer at the contact details above.

For Arunis Abode Limited
Sd/-
Garima Mandhania
Company Secretary and Compliance Officer

Place: Mumbai
Date: 20th August 2024

FRANKLIN TEMPLETON

Franklin Templeton Mutual Fund
Registered Office: One International Center, Tower 2, 12th and 13th Floor, Senapati Bapat Marg, Elphinstone Road (West), Mumbai 400013

Income Distribution cum capital withdrawal (IDCW) in Franklin India Focused Equity Fund and Franklin India Debt Hybrid Fund.

The Trustees of Franklin Templeton Mutual Fund have decided to distribute the following Income Distribution cum capital withdrawal (IDCW):

Name of the Schemes / Plans / Options	Face Value per Unit (₹)	Amount of IDCW per Unit (₹)	NAV per Unit as on August 19, 2024 (₹)
Franklin India Focused Equity Fund (FIFE)			
FIFE - IDCW Plan		3.350	42.0391
FIFE - IDCW Plan- Direct	10.00	4.000	49.5300
Franklin India Debt Hybrid Fund (FIDHF)			
FIDHF - Monthly IDCW Plan		0.085	13.4891
FIDHF - Monthly IDCW Plan- Direct	10.00	0.095	15.2751

The Record Date for the same will be August 23, 2024 (Friday). If in case the Record Date falls on a non-Business Day, the immediately following Business Day shall be the Record Date. All the Unitholders / Beneficial Owners of the IDCW plan / option of the scheme whose names appear in the records of Registrar / Depositories as on the Record Date shall be entitled to receive IDCW. The investors in the IDCW re-investment plan/option will be allotted units for the IDCW amount at the NAV of next Business Day after the Record Date.

Please note that the IDCW payout shall be subject to the availability of distributable surplus and if the available distributable surplus as on the record date is lower than the aforementioned IDCW rate, then the available distributable surplus shall be paid out. The payout shall be subject to tax deducted at source i.e. TDS, as applicable.

Pursuant to payment of IDCW, the NAV of the scheme would fall to the extent of payout and statutory levy (if applicable).

For Franklin Templeton Asset Management (India) Pvt. Ltd. (Investment Manager of Franklin Templeton Mutual Fund)

Sd/-
Authorized Signatory
Date: August 20, 2024

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY AND IS NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES UNDER THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018, AS AMENDED ("SEBI ICDR REGULATIONS"). INITIAL PUBLIC OFFERING OF EQUITY SHARES ON THE MAIN BOARD OF THE STOCK EXCHANGES IN COMPLIANCE WITH CHAPTER II OF THE SEBI ICDR REGULATIONS. NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION DIRECTLY OR INDIRECTLY, OUTSIDE INDIA.

PUBLIC ANNOUNCEMENT

INNOVISION LIMITED

The Company was incorporated as 'SRT Innovision Services Private Limited' as a private limited company under Companies Act, 1956, pursuant to a certificate of incorporation dated January 11, 2007, issued by Registrar of Companies, National Capital Territory of Delhi and Haryana, India. The Company was converted into a public limited company pursuant to a resolution passed at the meeting of the Board of Directors held on October 24, 2010, and a special resolution passed in the extraordinary general meeting of the Shareholders held on November 19, 2010, and consequently, the name of the Company was changed to, 'SRT Innovision Services Limited' and a fresh certificate of incorporation dated December 22, 2010, was issued by the RoC. Thereafter, the name of the Company was changed to 'Innovision Limited' pursuant to resolution passed at the meeting of the Board of Directors held on January 17, 2011, and a special resolution passed in the extraordinary general meeting of the Shareholders held on February 8, 2011 and certificate of incorporation dated March 2, 2011, issued by the RoC consequent to change of name. For details relating, please see section titled "History and Certain Corporate Matters" on page 206 of the draft red herring prospectus dated August 19, 2024 (the "DRHP"), filed with the securities and exchange board of India ("SEBI") on August 19, 2024.

Corporate Identity Number: U74910DL2007PLC157700
Registered Office: 1/209, First Floor, Sadar Bazar, Delhi Cantt, Delhi - 110 010, India; Telephone: +91 011 0289 7903;
Corporate Office: Plot 251, 1st Floor, Udjoy Vihar Phase-4, Gurgaon, Haryana - 122 015; Telephone: +91 124 438 7354
Contact Person: Jyoti Sachdeva, Company Secretary and Compliance Officer; Telephone: +91 124 438 7354; Email: cs@innovision.co.in; Website: www.innovision.co.in

THE PROMOTERS: LT COL RANDEEP HUNDAL AND UDAY PAL SINGH

INITIAL PUBLIC OFFER OF UP TO [•] EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH ("EQUITY SHARES") OF INNOVISION LIMITED ("COMPANY" OR "ISSUER") FOR CASH AT A PRICE OF ₹[•] PER EQUITY SHARE (INCLUDING A SHARE PREMIUM OF ₹[•] PER EQUITY SHARE) ("OFFER PRICE") AGGREGATING UP TO ₹[•] MILLION ("OFFER") COMPRISING A FRESH ISSUE OF UP TO [•] EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH AGGREGATING UP TO ₹ 3,150 MILLION BY THE COMPANY (THE "FRESH ISSUE") AND AN OFFER FOR SALE OF UP TO 11,81,250 EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH AGGREGATING UP TO ₹[•] MILLION BY THE PROMOTER SELLING SHAREHOLDERS ("OFFER FOR SALE") COMPRISING UP TO 5,90,625 EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH AGGREGATING UP TO ₹[•] MILLION BY LT COL RANDEEP HUNDAL AND UP TO 5,90,625 EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH AGGREGATING UP TO ₹[•] MILLION BY UDAY PAL SINGH (COLLECTIVELY, THE "PROMOTER SELLING SHAREHOLDERS" AND SUCH EQUITY SHARES, THE "OFFERED SHARES"). THE OFFER SHALL CONSTITUTE [•]% OF THE POST-OFFER PAID-UP SHARE CAPITAL OF THE COMPANY.

THE FACE VALUE OF THE EQUITY SHARES IS ₹10 EACH. THE PRICE BAND AND THE MINIMUM BID LOT SIZE WILL BE DECIDED BY THE COMPANY IN CONSULTATION WITH THE BRLM AND WILL BE ADVERTISED IN [•] EDITIONS OF THE [•], AN ENGLISH LANGUAGE NATIONAL DAILY NEWSPAPER WITH WIDE CIRCULATION, AND [•] EDITIONS OF [•], A HINDI LANGUAGE NATIONAL DAILY NEWSPAPER WITH WIDE CIRCULATION (HINDI ALSO BEING THE REGIONAL LANGUAGE OF DELHI WHERE OUR REGISTERED OFFICE IS LOCATED), AT LEAST 2 WORKING DAYS PRIOR TO THE BID/OFFER OPENING DATE AND SHALL BE MADE AVAILABLE TO THE STOCK EXCHANGES FOR THE PURPOSE OF UPLOADING ON THEIR RESPECTIVE WEBSITES, IN ACCORDANCE WITH THE SEBI ICDR REGULATIONS.

In case of any revision in the Price Band, the Bid/ Offer Period shall be extended for at least three additional Working Days after such revision of the Price Band, subject to the total Bid/ Offer Period not exceeding ten Working Days. In cases of force majeure, banking strike or similar circumstances, the Company and the Promoter Selling Shareholders, in consultation with the BRLM, for reasons to be recorded in writing, extending the Bid / Offer Period for a minimum of one Working Day, subject to the Bid/ Offer Period not exceeding ten Working Days. Any revision in the Price Band, and the revised Bid/ Offer Period, if applicable, shall be widely disseminated by notification to the Stock Exchanges by issuing a public notice and also by indicating the change on the respective websites of the BRLM and at the terminals of the members of the Syndicate and by intimation to the Self-Certified Syndicate Banks ("SCSBs") and other Designated Intermediaries and Sponsor Bank(s), as applicable.

The Offer is being made in terms of Rule 19(2)(b) of the Securities Contracts (Regulation) Rules, 1957, as amended, (the "SCRR") read with Regulation 31 of the SEBI ICDR Regulations. The Offer is being made through the Book Building Process, in compliance with Regulation 6(2) of the SEBI ICDR Regulations, where at least 75% of the Offer shall be available for allocation on a proportionate basis to Qualified Institutional Buyers ("QIBs") (the "QIB Category"), provided that the Company and Promoter Selling Shareholders in consultation with the BRLM, may allocate up to 60% of the QIB Category to Anchor Investors, on a discretionary basis (the "Anchor Investor Portion"), of which one-third shall be reserved for domestic Mutual Funds, subject to valid Bids being received from domestic Mutual Funds at or above the price at which Equity Shares are allocated to Anchor Investors. In the event of under-subscription or non-allocation in the Anchor Investor Portion, the balance Equity Shares of face value ₹ 10 each shall be added to the QIB Category (excluding the Anchor Investor Portion) ("Net QIB Category"). Further, 5% of the Net QIB Category shall be available for allocation on a proportionate basis to Mutual Funds only and the remainder of the Net QIB Category shall be available for allocation on a proportionate basis to all QIBs, including Mutual Funds. Subject to valid Bids being received at or above the Offer Price. If at least 75% of the Offer cannot be Allotted to QIBs, then the entire application money will be refunded forthwith. Further, not more than 15% of the Offer shall be available for allocation to non-institutional investors ("Non-Institutional Investors" or "Nils") ("Non-Institutional Category") of which one-third of the Non-Institutional Category shall be available for allocation to Bidders with a Bid size of more than ₹200,000 and up to ₹1,000,000 and two-thirds shall be available for allocation to Bidders with a Bid size of more than ₹1,000,000 provided that under-subscription in either of these two sub-categories of Non-Institutional Category may be allocated to Bidders in the other sub-category of Non-Institutional Category in accordance with the SEBI ICDR Regulations, subject to valid Bids being received at or above the Offer Price. Further, not more than 10% of the Offer shall be available for allocation to retail individual investors ("Retail Individual Investors" or "RIs") in accordance with the SEBI ICDR Regulations, subject to valid Bids being received at or above the Offer Price. All Bidders (other than Anchor Investors) shall mandatorily participate in this Offer through the Application Supported by Block Amount ("ASBA") process, and shall provide details of their respective bank account (including UPI ID for UPI Investors (defined hereinafter)) in which the Bid Amount will be blocked by the SCSBs or the Sponsor Banks, as the case may be. Anchor Investors are not permitted to participate in the Offer through the ASBA process. For details, specific attention is invited to section titled "Offer Procedure" on page 375 of the DRHP.

This public announcement is being made in compliance with the provisions of Regulation 26(2) of the SEBI ICDR Regulations to inform the public that the Company is proposing to undertake, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, an initial public offering of its Equity Shares pursuant to the Offer and has filed the DRHP with SEBI and with the Stock Exchanges on August 19, 2024.

Pursuant to Regulation 26(1) of the SEBI ICDR Regulations, the DRHP filed with SEBI shall be made available to the public for comments, if any, for period of at least 21 days, from the date of such filing by hosting it on the website of SEBI at www.sebi.gov.in, on the websites of the Stock Exchanges, i.e., BSE at www.bseindia.com, NSE at www.nseindia.com where the equity shares are proposed to be listed, the website of the BRLM, i.e., Emkay Global Financial Services Limited at www.emkayglobal.com and the website of the Company at www.innovision.co.in. The Company hereby invites the public to give their comments on the DRHP filed with SEBI with respect to disclosures made in the DRHP. The public are requested to send a copy of their comments to SEBI and/or to the Company Secretary and Compliance Officer of the Company and/or the BRLM at their respective addresses mentioned herein. All comments must be received by SEBI and/or the Company and/or the BRLM and/or the Company Secretary and Compliance Officer of the Company at their respective addresses mentioned herein in relation to the Offer on or before 5:00 p.m. on the 21st day from the aforesaid date of filing of the DRHP with SEBI.

Investment in equity and equity-related securities involve a degree of risk and investors should not invest any funds in the Offer unless they are confident to take the risk of losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in the Offer. For taking an investment decision, investors must rely on their own examination of the Company and the Offer, including the risks involved. The Equity Shares of face value ₹ 10 each in the Offer have not been recommended or approved by the SEBI, nor does SEBI guarantee the accuracy or adequacy of the contents of the DRHP. Specific attention of the investors is invited to the section titled "Risk Factors" on page 30 of the DRHP.

Any decision to invest in the Equity Shares described in the DRHP may only be made after the red herring prospectus ("Red Herring Prospectus") has been filed with the RoC and must be made solely on the basis of such Red Herring Prospectus as there may be material changes in the Red Herring Prospectus from the DRHP.

The Equity Shares, when offered, through the Red Herring Prospectus, are proposed to be listed on the Stock Exchanges.

For details of the main objects of the Company as contained in its Memorandum of Association, see "History and Certain Corporate Matters" on page 206 of the DRHP.

The liability of the members of the Company is limited. For details of the share capital, capital structure of the Company and the names of the signatories to the Memorandum of Association and the number of shares subscribed by them see "Capital Structure" on page 77 of the DRHP.

BOOK RUNNING LEAD MANAGER

REGISTRAR TO THE OFFER

Emkay
Your success is our business.

EMKAY GLOBAL FINANCIAL SERVICES LIMITED
The Ruby, 7th Floor, Senapati Bapat Marg, Dadar (West), Mumbai 400 028, Maharashtra, India
Telephone: +91 22 6612 1212; Email: innovision ipo@emkayglobal.com
Investor Grievance Email: ig@emkayglobal.com
Website: www.emkayglobal.com
Contact Person: Pranav Nagar / Pooja Saravankar
SEBI registration number: INM000011229

KFINTECH
KFIN TECHNOLOGIES LIMITED
Selenium, Tower B, Plot No. 31 and 32 Financial District, Nanakramguda, Serilingampally Hyderabad, Rangareddy 500 032, Telangana, India
Telephone: +91 40 6716 2222; Toll Free No.: 18003094001
E-mail: innovision ipo@kfinitech.com; Website: www.kfinitech.com
Investor grievance e-mail: einward.krisna@kfinitech.com
Contact Person: M. Murali Krishna
SEBI registration number: INR000000221

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the DRHP

For INNOVISION LIMITED
On behalf of the Board of Directors
Sd/-
Jyoti Sachdeva
Company Secretary and Compliance Officer

Date : August 20, 2024
Place : Delhi

INNOVISION LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offer of its Equity Shares and has filed the DRHP dated August 19, 2024 with SEBI and the Stock Exchanges on August 19, 2024. The DRHP shall be available on the website of SEBI at www.sebi.gov.in, on the websites of the Stock Exchanges i.e., BSE at www.bseindia.com, NSE at www.nseindia.com, the website of the BRLM, i.e., Emkay Global Financial Services Limited at www.emkayglobal.com and the website of the Company at www.innovision.co.in. Potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see the section titled "Risk Factors" on page 30 of the DRHP. Potential investors should not rely on the DRHP filed with SEBI for making any investment decision.

The Equity Shares offered in the Offer have not been and will not be registered under the U.S. Securities Act or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and in accordance with any applicable U.S. state securities laws. Accordingly, the Equity Shares are being offered and sold only outside the United States in 'offshore transactions' as defined in, and in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdictions where such offers and sales are made.

CONCEPT

RPtech

RASHI PERIPHERALS LIMITED
(Formerly Known as Rashi Peripherals Private Limited)
CIN - L30007MH1989PLC051039, Registered Office: Aristo House, 5th Floor, Corner of Telli Galli, Andheri (East), Mumbai, Maharashtra, India, 400069,
Tel: +91-22-6177 1771 | Fax +91-22-61771999,
E-mail: investors@rptechindia.com, Website: www.rptechindia.com

INFORMATION REGARDING 35TH ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") / OTHER AUDIO VISUAL MEANS ("OAVM")

NOTICE is hereby given that the 35th Annual General Meeting ("AGM") of Rashi Peripherals Limited ("the Company") will be held on Tuesday, September 17, 2024 at 4.00 p.m. (IST) through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM"), in compliance with the General Circular 09/2023 dated September 25, 2023 issued by Ministry of Corporate Affairs (MCA) read with other relevant circulars issued in this regard and SEBI/HO/CFD/POD-2/PIR/CIR/2023/167 dated October 07, 2023 issued by SEBI (hereinafter collectively referred to as "the circulars") and all other applicable laws, to transact the business set forth in the Notice of the AGM which will be circulated for convening the AGM. The Shareholders can attend and participate in AGM through the VC/OAVM facility only and their attendance will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The instructions for joining the AGM are being provided in the Notice of the AGM. The deemed venue for the 35th AGM shall be the Registered Office of the Company.

In Compliance with the aforementioned circulars, the Notice of the AGM along with the Annual Report for the Financial Year 2023-24 ("Annual Report") is being sent only by electronic mode to those Shareholders whose e-mail addresses are registered with the Company/ Depository Participants ("Depositories/DPs"/Registrar and Share Transfer Agent ("RTA") in accordance with the aforesaid MCA circulars and said SEBI Circulars. However, in line with SEBI relevant Circulars hard copy of the Notice of the 35th AGM and the Annual Report will be sent to those Shareholders who specifically request for the same by e-mail to investors@rptechindia.com duly quoting their Client ID.

The Notice of the AGM and Annual Report will also be available on the website of the Company at www.rptechindia.com and website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited (NSE) at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com.

The Company is pleased to provide the facility of e-voting to its Shareholders, to enable them to cast their votes on the resolutions proposed to be passed at the AGM by electronic means, using remote e-voting system as well as e-voting during the proceeding of the AGM ("collectively referred as e-voting"). The voting rights on the resolutions as set out in the Notice will be in proportion to shares held by the Shareholders of the paid-up equity share capital of the Company as on the cut-off date i.e., Tuesday, September 10, 2024. The Company has engaged the services of National Securities Depository Limited (NSDL), for providing the e-voting facility to the Shareholders. The instructions for e-voting are provided in the Notice of the AGM. The remote e - voting facility would be available during the following period:

Commencement of e - voting	From 9:00 a.m. (IST) on Friday, September 13, 2024
End of e - voting	Upto 5.00 p.m. (IST) on Monday, September 16, 2024

Shareholders whose Email IDs are already registered with the Company/Depository/RTA, may follow the Instructions for e-voting as provided in the Notice of the AGM.

In case, the Shareholders who have still not registered their e-mail ID are requested register their email address in their Demat account as per the process advised by their Depository Participant (DP).

The Board of Directors has recommended a final dividend of Rs 1 per share (20%) on face value of Rs 5 each for the year ended 31st March, 2024 for consideration of the shareholder. The Dividend, if approved, will be payable to those Shareholders whose names are registered as such in the Register of Shareholders of the Company as on Friday, August 23, 2024 (Record Date), subject to deduction of tax at source where applicable.

Pursuant to Finance Act 2020, dividend income will be taxable in the hands of Shareholders with effect from April 1, 2020 and the Company is required to deduct tax at source from dividend paid to the Shareholders at the prescribed rates. For the prescribed rates for various categories, the Shareholders are requested to refer to the Finance Act, 2020 and amendments thereof. Shareholders are also requested to refer to the Notice of the AGM for more details on process to be followed from their side, if any, in this regard.

As per the applicable circulars, payment of dividend shall be made through electronic mode to the shareholders who have updated their bank account details. SEBI vide its various circulars has mandated that dividend shall be paid only through electronic mode with effect from April 1, 2024. Such payment shall be made only after the Shareholders furnish their PAN, contact details (postal address with PIN and mobile number), bank account details & specimen signature ("KYC") and choice of Nomination. To avoid delay in receiving dividend, shareholders are requested to update their bank details with their Depository Participants, in case the shares are held in dematerialised mode.

In order to receive Annual Report, Notice, login details and also dividend on time, the Company requests all the Shareholders who have not yet registered or updated their email addresses, PAN, Bank Mandate and other information if any, with their Depository Participants with whom they maintain their demat accounts.

The above information is being issued for the benefit of all the Shareholders of the Company in compliance with the relevant circulars issued by MCA. This information is also available on the Company's website at www.rptechindia.com.

For RASHI PERIPHERALS LIMITED
(Formerly known as Rashi Peripherals Private Limited)
HINAL SHAH
Company Secretary & Compliance Officer
Membership No.: F10869

Place: Mumbai
Date: August 21, 2024

NANAI DAIRY PRIVATE LIMITED - IN LIQUIDATION
CIN: U15209MH2009PTC189530
Regd. Add: G - 1, Avistar Empress, ICW Chitale Path, Behind Portuguese Church, Dadar (W), Mumbai - 400028, Maharashtra, India.

E-Auction Notice

Sale of Assets of Nanai Dairy Private Limited ("Corporate Debtor") under the Insolvency and Bankruptcy Code, 2016 r/w IBBI (Liquidation Process) Regulations, 2016.
Date and Time of E-Auction: 18th September, 2024 at 11:00 AM to 02:00 PM (With the unlimited extension of 10 minutes each)

Sale of Asset of Corporate Debtor by the Liquidator appointed by the Hon'ble National Company Law Tribunal, Mumbai Bench vide order dated 13th October 2023 in I.A. 3310 OF 2023 IN C.P.(IB) No. 4455 of 2019. The sale will be done by the undersigned through the E-auction platform <https://eauctions.co.in> (Linkstar Infosys Private Limited)

Details of Assets	Block	Reserve Price	Earnest Money Deposit	Incremental Value
Plant & Machinery collectively consisting of Milk Processing Plant, Vacuum Milking Plant with accessories, S.S. Automatic Volumetric filling machine, cream Separator tanks etc. currently at Pali Budruk, Tal. Panvel, Dist. Raigad, Maharashtra - 410 206 (Complete list as available with Liquidator mentioned in detailed Auction Process Document)	1	₹ 18,37,000/-	₹ 1,80,000/-	₹ 25,000/-

Last date of submission of Eligibility Documents: 4th September, 2024 in the manner mentioned in detail E-auction Process Document
Declaration of Eligibility Bidder: 6th September, 2024
Inspection of Assets of Corporate Debtor: From 7th September, 2024 to 14th September, 2024.
Last Date for submission of Earnest Money Deposit: 16th September, 2024
Date and time of E-Auction for qualified bidders: 18th September, 2024 at 11:00 AM to 02:00 PM

Terms & Conditions of the sale is as under:

- E-Auction will be conducted on "AS IS WHERE IS" as such sale is without any kind of warranties and indemnities through approved service provider Linkstar Infosys Private Limited. Contact person on behalf of E-Auction Agency (Linkstar): Contact person: Mr. Dixit Prajapati Email admin@eauctions.co.in, Mobile No.: +91 9870099713 2. Eligibility Documents shall be submitted to Liquidator through email and hard copy in the form prescribed in the detailed E-auction Process Document on or before 4th September, 2024 before. The bid form along with detailed terms & conditions of the complete E-auction process can be downloaded from the website <https://eauctions.co.in>. 3. It is clarified that this invitation purports to invite prospective bidders and does not create any kind of binding obligation on the part of the Liquidator or the Company to effectuate the sale. The Liquidator reserves the right to cancel or modify the process and/or not to accept and/or disqualify any interested party / potential investor/bidder without assigning any reason and without any liability. 4. All the terms and conditions are to be mandatorily referred from the detailed E-Auction Process Document, prior to submission of EMD and participation in the process. The Liquidator can be contacted at lqnanaid@gmail.com.

CA Prashant Jain
Date: 21.08.2024
Place: Navi Mumbai
Liquidator - Nanai Dairy Private Limited
IBBI Reg. No.: IBBI/HPA-001/PP-P01368/2018-2019/12131
AFA valid till 24th September, 2024
Email ID: iprashantjain@gmail.com; lqnanaid@gmail.com
Correspondence Address: SSARVI Resolution Services LLP, B-610, BSEL Tech Park, Sec. 30 A, Vashi, Navi Mumbai-400 705
Contact No: +91 9826207703 (Call on WhatsApp)

Stressed Asset Management Branch Mumbai,
Office No- 73, 7th Floor Millit Chambers, Nariman Point, Mumbai-400021
Email: sambmumbai@indianbank.co.in

Sale notice for sale of immovable properties APPENDIX- IV-A [See provision to rule 8 (6)]

E-auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable properties mortgaged/charged to the Secured Creditors, the Symbolic possession for the properties of which has been taken by the Authorised Officer of Indian Bank, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 11.09.2024 for recovery of total outstanding amount of following dues to the Secured Creditors:-

- (1) Indian Bank, for an amount of Rs 18,00,15,530.05/- (In words Rupees Eighteen Crore Fifteen Thousand Five Hundred Thirty Five Paise only) as on 15.08.2024 with further interest, costs, other charges and expenses thereon from 16.08.2024.
- (2) Union Bank of India, for an amount of Rs. 16,26,89,986.78/- (In words Rupees Eighteen Crore Twenty Six Lakh Eighty Eight Thousand Nine Hundred Eighty Six & Paise Seventy Eight Only) as on 30.06.2024, with further interest, costs, other charges and expenses thereon from 01.07.2024.
- (3) Bank of Maharashtra, for an amount of Rs. 7,65,30,233.00/- (In words Rupees Seven Crore Eighty Five Lakhs Thirty Thousand Two Hundred Thirty Three only) as on 30.06.2024, with further interest, costs, other charges and expenses thereon from 01.07.2024.

(Name and address of the borrower/guarantors)
1. Ms. Priya Limited (Company) 2. Mrs. Saroj Bhawania (Director) 3. Mr. Ashish Bhawania (Director) 4. M/s. Cheshire Properties Investment Pvt Ltd (Guarantor) 5. M/s. Brent Properties Investment Pvt Ltd (Guarantor)

All Add Are Same - 4th Floor, Kmatraj Building 77-79, Maharashtra Karve Marg Marine Lines East Mumbai -400002, Maharashtra.

The specific details of the property intended to be brought to sale through e-auction mode are enumerated below:

Detailed description of the Property- EM of Office premises Nos 1 & II of the group at 5th Floor (known as 251 & 252) Bldg No. 2, Solitaire Corporate Park, Sir M. V. Road, Andheri East, and Mumbai. Unit I owned by M/s. Cheshire Properties Investment Pvt. Ltd. Unit II owned by M/s. Brent Properties Investment Pvt. Ltd. Admeasuring built up area of both units 3525 sq.ft. carpet Boundaries as under: East by Internal Road, West by Solitaire Gazbia Building, North by Building No. 1, South by Building No. 3	Reserve Price: Rs. 800.00 Lakhs	EMD (Rs.) in lakhs:- Rs. 80.00 Lakhs
Bid incremental amount:- Rs. 1,00,000/- (Rs. One Lakh only)	Date and time of e-auction:- 11.09.2024, 11:00AM TO 4:00P.M.	
Property ID No. IDIB3016339909B	Encumbrances on Property:- Not known to us	

Bidders are advised to visit the website (<https://www.ebkray.in>) of our e-auction service provider PSB Alliance Pvt. Ltd. to participate in online bid. For Technical Assistance Please call 8291220220. For Registration status and for EMD status please email to support.ebkray@psballiance.com.

For property details and photograph of the property and auction terms and conditions please visit: <https://www.ebkray.in> and for clarifications related to this portal, please contact PSB Alliance Pvt. Ltd. Contact No. 8291220220.

Bidders are advised to use Property ID Number mentioned above while searching for the property in the website with <https://www.ebkray.in>

The inspection of the Schedule mentioned properties (Wherever applicable) and related documents and up to date EC etc (at branch) by the intending purchasers/bidders may be done at their expense on 01.09.2024 between 1.00 pm to 4.00 pm.

Contact Number of Authorized Officer: -Mr. Deepak Kumar Vaishnav-99500-75555.

Bank Website www.indianbank.in	E-auction website	Document (Sale Notice Image)	Photos of Property

Date : 16.08.2024
Place : Mumbai

Lead by Indian Bank Consortium comprising of Union Bank of India & Bank of Maharashtra

